

## પ્રમુખીય લોકશાહી: એક વિચારણા

**કોઈ** પણ રાજકીય વ્યવસ્થા લોકશાહીનો પરિપૂર્ણ ઉકેલ બની શકે નહીં. આ સ્થિતિમાં આપણે જ આપણું ઘડતર અને ચાણતર સતત કરતા રહેવું જોઈએ. આપણે આપણી હાલની સંસ્કૃતીય લોકશાહીને માર્ક આપવાના હોય તો આપણે ખરેખર નિરાશ થવાચ તેટલા માર્ક આપવા પડે. આપણે અપનાંઘેલી સંસ્કૃતીય શાસનપદ્ધતિના વિકલ્પ તરીકે પ્રમુખશાહી શાસનપદ્ધતિની અવારનવાર ચર્ચાવિચારણા થતી રહી છે. પ્રમુખશાહી શાસનપદ્ધતિ વિશે ચર્ચા કરતાં પહેલાં સંસ્કૃતીય શાસનપદ્ધતિ વિશે થોડું જાણી લઈએ.

આપણે અપનાંઘેલી સંસ્કૃતીય પ્રણાલી અનુસાર,

સામાન્ય સંજોગોમાં દર

પાંચ વર્ષે ચૂંટણીઓ

યોજાય છે. જે પક્ષને

ચોખ્ખી બહુમતી મળે છે

એ પક્ષ સરકાર રચે છે.

કોઈ એક પક્ષ ચોખ્ખી

બહુમતી મેળવવામાં

નિષ્ફળ નીવડે તો સમજૂતી સાધનાર જે અથવા

વધુ પક્ષો ભેગા મળી ભિન્ન સરકાર રચે છે.

બહુમતી મેળવનાર પક્ષ (અથવા પક્ષો) વડા

પ્રધાનના હોદા માટે નેતાની ચૂંટણી કરે છે. આ

નેતા પોતાના પક્ષના ચૂંટાયેલા સભ્યો પસંદ કરીને

પ્રધાનમંડળની રચના કરે છે. કોઈ પ્રધાન સંસદમાં

ચૂંટાયેલો ન હોય તો તેણે છ મહિનાની અંદર

સંસદના ઉપલા (રાજ્યસભા) અથવા નીચલા

(લોકસભા) ગૃહમાં ચૂંટાઈ આવવું પડે છે.

સરકારના વડા તરીકેનો હોદો રાષ્ટ્રપ્રમુખ ભોગાયે

છે. વડા પ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાચ

રાષ્ટ્રપ્રમુખને મદદ કરવાનું અથવા સલાહસૂચન

આપવાનું છે. પણ પ્રણાલિકા તેમ જ કાચદા પ્રમાણે

પ્રમુખને વડા પ્રધાનની સલાહ અનુસાર જ વર્તવું પડે છે. બ્રિટનના રાજીવીની માફક રાષ્ટ્રપ્રમુખને નામે શાસન ચલાવવામાં આવે છે, પણ ખરી છૂંટ રાષ્ટ્રપ્રમુખના હાથમાં હોતી નથી.

વિશ્વના ધાણા દેશોમાં પ્રમુખશાહી શાસનપદ્ધતિની સરકાર અસ્થિત્વમાં છે. આવા દેશોમાં સંપૂર્ણપણે લોકશાહી ટબના અંકુશો અને સમતુલાના સિદ્ધાંત પર રચાયેલી પ્રમુખશાહી શાસનપદ્ધતિના સૌથી સફળ ઉદાહરણો અમેરિકા (યુ.એસ.એ.) અને ફાન્ડનાં ટાંકી શકાય. અમેરિકાએ અપનાંઘેલી પ્રમુખશાહી પદ્ધતિમાં રાજ્યના વડાની- રાષ્ટ્રપ્રમુખની- લોકો દ્વારા સીધી ચૂંટણી થાય છે અને ચૂંટાયા પછી તે સંપૂર્ણ વહીવટી

સર્તાં ભોગાયે છે. પોતાની પસંદગીનું મંત્રીમંડળ નિયુક્ત કરવાનો સંપૂર્ણ છક પ્રમુખ ધરાવે છે. અમેરિકાનું બંધારણ મુખ્યાત્મે ‘સર્તાના વિભાજન’ પર ધડાયેલું

છે. તેમાં પ્રધાનમંડળ સંસદથી સંપૂર્ણપણે અલગ છે. પ્રધાનમંડળમાં પ્રતિભાશાળી, નિષ્ણાત અને પોતાના ક્ષેત્રમાં ડાંડી જાણકારી ધરાવનાર વ્યક્તિઓને પસંદગી આપવામાં આવે છે. સંસદના સભ્યને પ્રધાનમંડળમાં જોડાવું હોય તો પોતાની સંસ્કૃતીય બેઠકનું રાજ્યનામું આપવું પડે છે. તેની સાથ્યોસાથ પ્રમુખ પર અંકુશ રહેતે માટે પ્રમુખ કોઈ પણ ઉચ્ચ હોદા પર વહીવટી કે ન્યાયતંત્રને લગતી નિમાયુક્ત કરતા પહેલા નિયુક્ત થનાર વ્યક્તિ માટે સેનેટની (સંસદનું ઉપલું સભાગૃહ) મંજૂરી લેવી પડે છે. જોકે પોતાના મદદનીશને છૂટા કરતી વખતે પ્રમુખને આવી મંજૂરીની જરૂર રહેતી નથી.

(કુમશા:) ■

### શોકસ

જશવંત બી. મહેતા